



ગ્રામીણ કૃષિ મૌસમ સેવા
હવામાન આગાહી આધારીત કૃષિ સલાહ બુલેટીન
ઉત્તર સૌરાષ્ટ્ર ખેતઆબોહવાકીય વિભાગ
જુનાગઢ કૃષિ યુનીવર્સીટી, તરઘડિયા-૩૬૦૦૨૩
તા.૦૬-૦૯-૨૦૨૩ થી તા.૧૦-૦૯-૨૦૨૩



(ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, સૂકીખેતી સંશોધન કેન્દ્ર, જી.કે.યુ. તરઘડિયા અને ભારત મૌસમ વિભાગ દ્વારા સંપન્ન)
ગુજરાતના ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓનું કૃષિ હવામાન બુલેટીન નં. ૪૫/૨૦૨૩

પાછલા અઠવાડિયાનું રાજકોટનું હવામાન

હવામાન પરિબળો	
વરસાદ(મી.મી)	0.0
મહત્તમ તાપમાન(સે.ગ્રે)	33.4-34.7
લઘુતમ તાપમાન(સે.ગ્રે)	22.6-23.4
ભેજ (%)સવાર	76-84
ભેજ (%)બપોરબાદ	49-56
પવનનીગતિ (કિમી/કલાક)	1.3-4.0

હવામાન આગાહી :પત્રક-ક

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિભાગ-હવામાન આગાહી ૧૦-૦૯-૨૦૨૩ સવારના ૮.૩૦ સુધી

તા.૦૬-૦૯-૨૦૨૩ થી ૧૦-૦૯-૨૦૨૩

કૃષિસલાહ :

- ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ ,જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ,તરઘડીયા તરફથી જણાવવામાં આવે છે કે ,ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના

રાજકોટ :

તારીખ પેરામીટર	દિવસ-૧ ૦૬-૦૯-૨૦૨૩	દિવસ-૨ ૦૭-૦૯-૨૦૨૩	દિવસ-૩ ૦૮-૦૯-૨૦૨૩	દિવસ-૪ ૦૯-૦૯-૨૦૨૩	દિવસ-૫ ૧૦-૦૯-૨૦૨૩
વરસાદ(મી.મી.)	0	0	0	0	0
મહત્તમ તાપમાન(સે.ગ્રે)	35	36	36	36	35
લઘુતમ તાપમાન(સે.ગ્રે)	25	25	24	25	24
મહત્તમભેજ (%)સવાર	81	76	79	79	83
લઘુતમભેજ (%) બપોરબાદ	44	39	43	44	54
પવનની ગતિ (કિમી/કલાક)	17	22	25	26	26
પવનની દિશા(ડીગ્રી)	291	292	292	288	252
વાદળની સ્થિતિ(ઓકટા)	4	6	6	8	7

- રાજકોટ જિલ્લામાં આગામી તા.૦૬-૦૯-૨૦૨૩ થી તા.૧૦-૦૯-૨૦૨૩ દરમિયાન ગરમ, સૂકું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે.
- આ સમય ગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમિયાન ૩૫-૩૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમિયાન ૨૪-૨૫ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.
રાત્રી દરમિયાન ૨૫-૨૫ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

- આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૭૬-૮૩ અને ૩૯-૫૪ ટકા રહેશે.
- પવનની દિશા પશ્ચિમની રહેવાની અને ઝાટકા સાથે પવનની ઝડપ ૧૭ થી ૨૬ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

મોરબી:

તારીખ	દિવસ-૧	દિવસ-૨	દિવસ-૩	દિવસ-૪	દિવસ-૫
પેરામીટર	૦૬-૦૯-૨૦૨૩	૦૭-૦૯-૨૦૨૩	૦૮-૦૯-૨૦૨૩	૦૯-૦૯-૨૦૨૩	૧૦-૦૯-૨૦૨૩
વરસાદ(મી.મી.)	0	0	0	0	0
મહત્તમ તાપમાન(સે.ગ્રે)	35	36	36	36	35
લઘુત્તમ તાપમાન(સે.ગ્રે)	25	25	24	25	24
મહત્તમ ભેજ (%)સવાર	73	72	77	77	80
લઘુત્તમ ભેજ (%) બપોરબાદ	42	40	40	41	43
પવનની ગતિ (કિમી/કલાક)	19	24	27	29	31
પવનની દિશા (ડીગ્રી)	257	291	283	252	249
વાદળની સ્થિતિ (ઓકટા)	4	5	4	7	7

- મોરબી જીલ્લામાં આગામી તા.૦૬-૦૯-૨૦૨૩ થી તા.૧૦-૦૯-૨૦૨૩ દરમ્યાન ગરમ, સુકું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે.
- આ સમય ગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન ૩૫-૩૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુત્તમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૪-૨૫ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.
- આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૭૨-૮૦ અને ૪૦-૪૩ ટકા રહેશે.
- પવનની દિશા પશ્ચિમની રહેવાની અને ઝાટકા સાથે પવનની ઝડપ ૧૯ થી ૩૧ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

દેવભૂમિદ્વારકા:

તારીખ	દિવસ-૧	દિવસ-૨	દિવસ-૩	દિવસ-૪	દિવસ-૫
પેરામીટર	૦૬-૦૯-૨૦૨૩	૦૭-૦૯-૨૦૨૩	૦૮-૦૯-૨૦૨૩	૦૯-૦૯-૨૦૨૩	૧૦-૦૯-૨૦૨૩
વરસાદ(મી.મી.)	2	3	0	0	0
મહત્તમ તાપમાન(સે.ગ્રે)	32	33	32	32	32
લઘુત્તમ તાપમાન(સે.ગ્રે)	27	26	25	25	26
મહત્તમ ભેજ (%)સવાર	82	81	83	83	87
લઘુત્તમ ભેજ (%) બપોરબાદ	61	56	61	62	77
પવનની ગતિ(કિમી/કલાક)	17	21	26	27	27
પવનનીદિશા (ડીગ્રી)	257	292	292	283	252
વાદળની સ્થિતિ (ઓકટા)	4	4	5	8	7

- દેવભૂમિ દ્વારકાજીલ્લામાં આગામી તા.૦૬-૦૯-૨૦૨૩ થી તા.૧૦-૦૯-૨૦૨૩ દરમ્યાન ગરમ, સુકું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે અને તા. ૦૬ થી ૦૭ ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા થવાની શક્યતા છે.
- આ સમય ગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન ૩૨-૩૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુત્તમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૫-૨૭ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.
- આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૮૧-૮૭ અને ૫૬-૭૭ ટકા રહેશે.
- પવનની દિશા પશ્ચિમની રહેવાની અને ઝાટકા સાથે પવનની ઝડપ ૧૭ થી ૨૭ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

સુરેન્દ્રનગર :

તારીખ	દિવસ-૧	દિવસ-૨	દિવસ-૩	દિવસ-૪	દિવસ-૫
પેરામીટર	૦૬-૦૯-૨૦૨૩	૦૭-૦૯-૨૦૨૩	૦૮-૦૯-૨૦૨૩	૦૯-૦૯-૨૦૨૩	૧૦-૦૯-૨૦૨૩
વરસાદ (મી.મી.)	0	0	0	0	0

મહત્તમ તાપમાન (સે.ગ્રે)	35	36	36	36	35
લઘુત્તમ તાપમાન (સે.ગ્રે)	25	25	24	25	24
મહત્તમ ભેજ (%) સવાર	71	69	71	71	77
લઘુત્તમ ભેજ (%) બપોરબાદ	40	40	41	40	40
પવનની ગતિ(કિમી/કલાક)	18	23	26	27	27
પવનની દિશા (ડીગ્રી)	292	294	292	270	257
વાદળની સ્થિતિ(ઓકટા)	4	6	5	7	6

- સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા.૦૬-૦૯-૨૦૨૩ થી તા.૧૦-૦૯-૨૦૨૩ દરમિયાન ગરમ, સુકું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે.
- આ સમય ગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમિયાન ૩૫-૩૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુત્તમ તાપમાન રાત્રી દરમિયાન ૨૪-૨૫ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.
- આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૬૯-૭૭ અને ૪૦-૪૧ ટકા રહેશે.
- પવનની દિશા પશ્ચિમની રહેવાની અને ઝાટકા સાથે પવનની ઝડપ ૧૮ થી ૨૭ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

અમરેલી :

તારીખ	દિવસ-૧	દિવસ-૨	દિવસ-૩	દિવસ-૪	દિવસ-૫
પેરામીટર	૦૬-૦૯-૨૦૨૩	૦૭-૦૯-૨૦૨૩	૦૮-૦૯-૨૦૨૩	૦૯-૦૯-૨૦૨૩	૧૦-૦૯-૨૦૨૩
વરસાદ (મી.મી.)	1	2	8	3	5
મહત્તમ તાપમાન (સે.ગ્રે)	35	35	34	34	32
લઘુત્તમ તાપમાન (સે.ગ્રે)	25	25	25	26	25
મહત્તમ ભેજ (%) સવાર	84	77	79	81	85
લઘુત્તમ ભેજ (%) બપોરબાદ	48	42	44	48	56
પવનની ગતિ(કિમી/કલાક)	17	21	23	24	23
પવનની દિશા (ડીગ્રી)	283	292	292	288	288
વાદળની સ્થિતિ(ઓકટા)	4	6	7	8	7

- અમરેલી જિલ્લામાં આગામી તા.૦૬-૦૯-૨૦૨૩ થી તા.૧૦-૦૯-૨૦૨૩ દરમિયાન ગરમ, સુકું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે અને તા. ૦૬ થી ૧૦-સપ્ટેમ્બર ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા થવાની શક્યતા છે.
- આ સમય ગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમિયાન ૩૨-૩૫ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુત્તમ તાપમાન રાત્રી દરમિયાન ૨૫-૨૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.
- આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૭૭-૮૫ અને ૪૨-૫૬ ટકા રહેશે.
- પવનની દિશા પશ્ચિમની રહેવાની અને ઝાટકા સાથે પવનની ઝડપ ૧૭ થી ૨૪ કીમી/કલાક રહેવાની શક્યતા છે.



જામનગર :


તારીખ	દિવસ-૧	દિવસ-૨	દિવસ-૩	દિવસ-૪	દિવસ-૫
પેરામીટર	૦૬-૦૯-૨૦૨૩	૦૭-૦૯-૨૦૨૩	૦૮-૦૯-૨૦૨૩	૦૯-૦૯-૨૦૨૩	૧૦-૦૯-૨૦૨૩
વરસાદ (મી.મી.)	0	0	0	0	0
મહત્તમ તાપમાન (સે.ગ્રે)	33	34	34	34	33
લઘુત્તમ તાપમાન (સે.ગ્રે)	25	25	24	25	24
મહત્તમ ભેજ (%) સવાર	82	80	83	82	86
લઘુત્તમ ભેજ (%) બપોરબાદ	51	50	54	55	70
પવનની ગતિ(કિમી/કલાક)	17	23	27	28	28
પવનની દિશા (ડીગ્રી)	288	292	292	283	249
વાદળની સ્થિતિ(ઓકટા)	4	5	5	8	7


- જામનગર જીલ્લામાં આગામી તા.૦૬-૦૮-૨૦૨૩ થી તા.૧૦-૦૮-૨૦૨૩ દરમ્યાન ગરમ, સુકું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે.
- આ સમય ગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન ૩૩-૩૪ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુત્તમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૪-૨૫ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.
- આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૮૦-૮૬ અને ૫૦-૭૦ ટકા રહેશે.
- પવનની દિશા પશ્ચિમની રહેવાની અને ઝાટકા સાથે પવનની ઝડપ ૧૭ થી ૨૮ કીમી/કલાક રહેવાની શક્યતા છે.


ઉભા પાકમાં વરસાદના અભાવે ભેજની ખેંચ હોય નીચે મુજબના પગલા લેવા.

- ઉભા પાકમાં ભેજ જળવાય રહે તે માટે શક્ય હોય ત્યાં આંતરખેડ કરવી અને
- પાકને સંપૂર્ણ નિંદામણ મુક્ત રાખવો.
- વરસાદને અભાવે જમીનમાં ભેજની ખેંચ હોય ત્યાં ઉભા પાકને ટીપા/સ્પ્રીન્કલર પધ્ધતિથી પિયત આપવું.
- ઉભા પાકમાં યુસીયા જીવાતોનું નિયંત્રણ કરવા ઈમીડાક્લોપ્રીડ ૩૦.૫ ટકા ૪ મી.લી. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરીને છાંટવી.
- ભેજની ખેંચ હોય ત્યારે કોઇપણ પ્રકારના ખાતરનો છંટકાવ કરવો નહિ.
- ભેજની અછતની સ્થિતિમાં મગફળી અને કપાસના પાકમાં કેઓલીન ૪૦૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
- ઉભા પાકમાં ભેજ બચાવવા ઘઉંના કુંવર, મગફળીની ફોતરી તેમજ અન્ય હાથવગી ખેત આડપેદાશનું આવરણ કરવું.
- તા. ૧૦ થી ૧૫-સપ્ટેમ્બર-૨૦૨૩: હવામાન આગોતરો વરતારો : તા. ૧૦ થી ૧૫-સપ્ટેમ્બર -૨૦૨૩ દરમ્યાન ભેજવાળું અને અંશત: વાદળછાયું હવામાન રહેવાની સંભાવના છે.
- હવામાન ચેતવણી : નથી
- મોબાઇલ સંદેશ : વરસાદને અભાવે જમીનમાં ભેજની ખેંચ હોય ત્યાં ઉભા પાકને ટીપા/સ્પ્રીન્કલર પધ્ધતિથી જરૂરિયાત મુજબ પિયત આપવું.

મુખ્યપાક	પાક અવસ્થા	રોગ/જીવાત/જાત	કૃષિસલાહ (૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી ભલામણ કરેલ દવા છાંટવી)
ચીમાસું મગફળી	ફૂલ અને સુયા બેસવા અને ડોડવા બંધાવવા	પાનના ટપકા  • નિંદામણ • સફેદ ફૂગ  • સફેદ મુંડા	<ul style="list-style-type: none"> સરકોસ્પોરા ફૂગનો પાનના ટપકાનો રોગ લાગે નહિ તે માટે ટેબ્યુકોનાઝોલ ૧૮.૩ ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. મગફળીમાં નિંદામણ કરવું. મગફળીમાં સફેદ ફૂગનો ઉપદ્રવ અટકાવવા ટ્રાયકોડર્મા ફૂગ ૨.૫ કી.ગ્રા./હે. મુજબ ગળતીયા દેશી ખાતર અથવા દિવેલાના ખોળ ૫૦૦ કી.ગ્રા./હે. મિશ્ર કરીને જમીનમાં આપવું. મુંડાના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ % અથવા ક્વીનાલફોસ ૨૫ % ઈ.સી. ૪ લીટર પ્રતિ હે. ડ્રેન્ચિંગ કરવું અથવા ક્લોરપાયરીફોસ ૨૦ % અથવા ક્વીનાલફોસ ૨૫ % ઈ.સી. ૪ લીટર દવાને ૧૦૦ કી.ગ્રા. રેતીમાં ભેળવીને એક હે. વિસ્તારમાં છાંટીને વરસાદ ણ હોય તો પિયત આપવું.

		 <p>લીલી ઈયળ અને લશ્કરી ઈયળ</p>	<ul style="list-style-type: none"> મગફળીમાં લીલી અને લશ્કરી ઈયળના નિયંત્રણ માટે બીવેરીયા બાસીયાના ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
કપાસ	ચાપવા , ફૂલ અને ઝીન્ડવા બંધાવવા	<p>શીપ્સ અને લીલી પોપટી</p> <p>પાનના ટપકા</p> <ul style="list-style-type: none"> નિંદામણ ગુલાબી ઈયળ 	<ul style="list-style-type: none"> આ હવામાન પરિસ્થિતિમાં કપાસમાં શીપ્સ અને લીલી પોપટીનો વધુ ઉપદ્રવ જોવા મળે છે જેના નિયંત્રણ માટે એસીફેટ ૭૫ % એસ.પી. ૧૫ ગ્રામ અથવા ફલોનીકામીડ ૫૦ % વે.ગ્રે. ૩ ગ્રામ સાથે લીબોળીનું ૧૫૦૦ પીપીએમ તેલ ૪૦ મીલી અથવા લીબોળીના મીજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી/૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. અલ્ટરનેરીઆ ફૂગનો પાનના ટપકાનો રોગ લાગે નહિ તે માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. જમીનમાં ભેજ સંગ્રહ માટે કપાસમાં આંતરખેડ અને નિંદામણ કરવું. કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળેલ છે. ગુલાબી ઈયળના ઉપદ્રવના મોનીટરીંગ માટે હેક્ટરે ૫ થિ ૬ ફેરોમેન ટ્રેપ ગોઠવવા. કપાસમાં ગુલાબી ઈયળથી નુકશાન પામેલ ફૂલ અને ચાપવા તોડીને જમીનમાં દાટી દેવા. વધુ નુકશાન હોય તો પ્રોફેનોફોસ ૫૦% ઈ.સી. ૨૦ મી.લી. અથવા સાયપરમેથ્રીન ૧૦ મિલી સાથે બીવેરીયા બાસીયાના ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. કપાસમાં વરાપે પાળા યડાવવા. બી.ટી. કપાસમાં યુરીયા અને એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ દરેક ૩૦ કી.ગ્રા./હે. પુરતી ખાતર તરીકે આપવું. બી.ટી. કપાસમાં ફૂલ ભમરી, ઝીન્ડવા બનવા અને ઝીન્ડવાના વિકાસની અવસ્થાએ ૨ ટકા પોટેશિયમ નાયટ્રેટના દ્રાવણનો (૧૦ લીટર પાણીમાં ૨૦૦ ગ્રામ) છંટકાવ કરવો. બી.ટી. કપાસમાં વાવેતર બાદ ૬૦, ૭૫ અને ૯૦ દિવસે ૧ ટકા મલ્ટી માયકોન્યુટ્રીયન્ટના દ્રાવણનો (૧૦ લીટર પાણીમાં ૧૦૦ ગ્રામ) છંટકાવ કરવો. બી.ટી. કપાસમાં ૪.૫ થી ૫ ફૂટની ઊંચાઈએ ઉપરની ટોચ કાપવી, જેથી સારો ફાલ લાગે. તેમજ કપાસમાં ફૂલ ભમરી ખરતી અટકાવવા અને સારા ફાલ માટે નેપ્થેલીન એસેટિકએસિડનું ૩૦ પીપીએમનું દ્રાવણ છાંટવું નેપ્થેલીન એસેટિક એસિડનું ૩૦ પીપીએમ દ્રાવણ છાંટવું (ખ્વાનોફીક્સ ૭.૫ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છાંટવું).
તલ	બૈઠા	<p>કાળીયો અને ફૂગનો પાનના ટપકારોગ</p>	<ul style="list-style-type: none"> તલમાં ફૂગજન્ય રોગ જેવા કે કાળીયો, પાનના ટપકાનો ઉપદ્રવ ના થાય તે માટે રીડોમિલ દવા ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. તલમાં પાન વાળનાર ઈયળનો વધુ ઉપદ્રવ હોય તો કાર્ટેપ હાયડ્રોક્લોરાઈડ ૧૫ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. અથવા લીબોળીના

		પાન વાળનાર ઈયળ પાન કથીરી	મીંજનું ૩ ટકા અર્કનું દ્રાવણ ૩૦૦ મીલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. • તલમાં પાન કથીરીના નિયંત્રણ માટે પ્રોપરગાઈટ દવા ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
બાજરી	દાણા ભરાવવા	--	-
મગ	શીંગ	-	• પાકી ગયેલ શીંગની વીણી કરવી.
અડદ	ફૂલ અને શીંગ	-	• -
ચોળી	શીંગ	-	• પાકી ગયેલ શીંગની વીણી કરવી.
તુવેર	વૃદ્ધિ	-	• -
દિવેલા	વૃદ્ધિ	લશ્કરી ઈયળ	• દિવેલામાં લશ્કરી અને ઘોડિયા ઈયળના નિયંત્રણ માટે એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ગ્રામ/૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છાંટવી. • જમીનમાં ભેજ સંગ્રહ માટે દીવેલામાં આંતરખેડ અને નિંદામણ કરવું.
તુરીયા, દૂધી, ગલકા, કારેલા, ગુવાર, કાકડી, તરબુચ	ફૂલ/ફળ	સફેદમાખી તળછારો	• વધારાના વરસાદી પાણીના નિકાલની કાળજી રાખવી. • વેલાવાળા શાકભાજીમાં સફેદ માખીના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી અને ઈમીડાક્લોપ્રીડ ૩૦.૫ ટકા ૪ મિલી અથવા એસીટેમાપ્રીડ ૨૦ ટકા ૫ ગ્રામ દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. • વેલાવાળા શાકભાજીમાં તળછારાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૪૦ ગ્રામ પ્રતિ પંપમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
ભીંડા	ફૂલ/ફળ	સફેદમાખી, પાનકથીરી	• સફેદ માખીના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી અને ડાયફેન્થાયુરોન ૫૦ ટકા વે.પા. ૧૬ ગ્રામ અથવા એસીટેમાપ્રીડ ૨૦ ટકા ૫ ગ્રામ દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. • ભીંડામાં જો પાન કથીરીનો ઉપદ્રવ હોય તો ઇથીઓન ૩૦ મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો. • ભીંડામાં જરૂરીયાત મુજબ હળવું પિયત આપવું. • ભીંડાની શીંગની વીણી બાદ ૨૦ કી.ગ્રા./હેક્ટર ચુરીયા ખાતર આપવું.
રીંગણી	ફૂલ/ફળ	સફેદમાખી ડુંખઅને→ ફળકોરીખાનારઈ યળ	➤ રીંગણીમાં સફેદ માખીના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી અને ડાયફેન્થાયુરોન ૫૦ ટકા વે.પા. ૧૬ ગ્રામ દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. ➤ ફળ અને ડોકાની ઈયળોનો ઉપદ્રવ હોય તો નુકશાન પામેલ ફળ અને ડોકા તોડીને જમીનમાં દાંટી દેવા અને ક્લોરાનટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી (રીનાક્ષીપાયર) દવા ૩ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.
મરચી	વૃદ્ધિ/ફૂલ/ફળ	થ્રીપ્સ,સફેદમાખી 	➤ પ્રોફેનોફોસ ૨૦ મીલી અને લીંબોળીનું તેલ ૫૦ મિલી અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મિલી ૧૦લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. થ્રીપ્સનો વધુ ઉપદ્રવ હોય તો

		પાન કથીરી	<p>સ્પીનોસાદ અથવા સ્પીનેટોરમ દવા ૭ મિલી. અથવા ફ્લુક્ષા મેટા માઈડ ૧૦ % ઈ.સી. ૧૬ મી.લી. પ્રતિ પંપ છાંટવી.</p> <ul style="list-style-type: none"> ➤ મરચીમાં જો પાનકથીરીનો ઉપદ્રવ હોય તો ઈથીઓન ૫૦ ટકા ઇસી ૧૫ મિલી અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈ.સી. ૧૦ મિલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. ➤ વાયરસના કારણે કોક્કાચેલ મરચીના છોડ ઉપાડીને જમીનમાં દાંટી દેવા અને ઉભા પાકમાં ઈમીડાકલોપ્રીડ ૩ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.
લીંબુ	ફળનો વિકાસ	<p>પાનકોરીયુ</p> <p>કથીરી →</p>  <p>બળીઆ ટપકા અને ગુંદરિયો</p>	<ul style="list-style-type: none"> • પાનકોરીયુના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૩૦.૫ ટકા ૫ મી.લી. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરીને છાંટવી. • લીંબુડીમાં જો પાનકથીરીનો ઉપદ્રવ હોય તો પ્રોપરગાઈટ ૫૭ ઈ.સી. ૧૦ મિલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. • લીંબુમાં બળીઆ ટપકા અને ગુંદરિયો રોગના નિયંત્રણ માટે કોપર ઓક્સી ક્લોરાઈડ ૪૦ ગ્રામ અને સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૧ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.
પશુ/મરઘા			<p>ઈતરડીના નિયંત્રણ માટે ડેલ્ટામેથ્રીન અથવા એમીટ્રાઝ ૨ મિ.લિ. એક લિટર પાણીમાં નાખીને છાંટવી. વિટામીન એ તથા ડી પુરકો આપવા. કરમિયાની દવા, ટી.બી. તથા જે.ડી ના રોગની પરખ કરાવવી. વરસાદના સમયે પશુઓને સુરક્ષીત જગ્યાએ રાખવા. યોમાસા દરમ્યાન જાનવરોને રહેઠાણની જગ્યાની વ્યવસ્થિત સફાઈ તેમજ માખીઓના ઉપદ્રવથી બચવા ફિનાઈલ છાંટવું. દુધાળા પ્રાણીઓને નિયમિત ૧ કિલ્લો ફીડ + ૫૦ ગ્રામ ખનીજ તત્વોનું મિશ્રણ પ્રતિ ૨ લીટર દુધની ઊપજના પ્રમાણમાં આપવું. તેમજ લીલું ઘાસ + સૂકું ઘાસ + ખનીજ તત્વો બોરાકમાં આપવા. દુધાળા પશુઓના આઉને ઝીંક ઓક્સાઈડ અથવા બોરિક પાવડરથી સાફ કરવું.</p>
નોંધ			<p>નીચેની એપ ડાઉનલોડ કરો</p> <ul style="list-style-type: none"> • મૌસમ એપ જીલ્લા પ્રમાણે હવામાન આગાહી અને ચેતવણી માટે. • મેઘદ્રૂત એપ હવામાન આધારિત કૃષિસલાહ બુલેટીન માટે. • દામીની એપ વરસાદી વીજળીની ચેતવણી માટે.

જા.નં.જુફ્યુ/સૂ.ખે./એગ્રોમેટ/બુલેટીન/ / ૨૦૨૩,
તરઘડિયા(રાજકોટ), તારીખ: ૦૫/૦૮/૨૦૨૩.

તંત્રીશ્રી/ડાયરેક્ટરશ્રી,
રાજકોટ,

ઉપરોક્ત માહિતી આપના દૈનિક સમાચાર પત્રોમાં, રેડીયોમાં ગામના ચોરાના કાર્યક્રમમાં તથા ટીવીના ગ્રામ્ય કાર્યક્રમમાં વિનામૂલ્યે પ્રસિધ્ધ કરાવવા નમ્ર વિનતી છે. સહકારની અપેક્ષા સહ આભાર.

ટેક્નીકલ ઓફિસર
સુકીખેતી સંશોધન કેન્દ્ર
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી
તરઘડિયા



Gramin Krushi Mausam Seva
Main Dry Farming Research Station
Junagadh Agricultural University
AMFU-Targhadia (Rajkot) - 360 023



Agromet Advisory Service bulletin No.45 for North Saurashtra districts (Gujarat)

(Issued jointly by AMFU-DFRS, J.A.U., Targhadia (Rajkot) & India Meteorological Department)

(Period for 06 to 10-September-2023)

Significant past weather for the preceding week of Rajkot

Rainfall (mm)	0.0
Maximum temperature (°C)	33.4-34.7
Minimum temperature (°C)	22.6-23.4
Relative Humidity (%) I	76-84
Relative Humidity (%) II	49-56
Wind speed (Kmph)	1.3-4.0

Weather forecast until 08-30 hrs. of 10/09/2023

(1) RAJKOT DISTRICT:

	06/09/2023	07/09/2023	08/09/2023	09/09/2023	10/09/2023
Rainfall (mm)	0	0	0	0	0
Max.Temp.(°C)	35	36	36	36	35
Min.Temp.(°C)	25	25	24	25	24
RH-I (%)	81	76	79	79	83
RH-II (%)	44	39	43	44	54
Wind Speed (kmph)	17	22	25	26	26
Wind Direction(deg.)	291	292	292	288	252
Total CC (octa)	4	6	6	8	7

- **General weather:** Dry, warm and partly cloudy to generally weather forecasted for next five days.
- **Rainfall:** No rainfall forecasted.
- **Temperature:** Maximum and minimum temperature likely to be in range of 35-36°C and 24-25°C, respectively.
- **Relative Humidity:** The RH-I and RH-II is likely to be in the range of 76-83% & 39-54, respectively.
- **Wind Direction and Speed:** Direction and speed of wind is likely to be W and 17-26 km/h, respectively.

(2) MORBI DISTRICT:

	06/09/2023	07/09/2023	08/09/2023	09/09/2023	10/09/2023
Rainfall (mm)	0	0	0	0	0
Max.Temp.(°C)	35	36	36	36	35
Min.Temp.(°C)	25	25	24	25	24
RH-I (%)	73	72	77	77	80
RH-II (%)	42	40	40	41	43
Wind Speed (kmph)	19	24	27	29	31
Wind Direction(deg.)	257	291	283	252	249
Total CC (octa)	4	5	4	7	7
<ul style="list-style-type: none"> • General weather: Dry, warm and partly cloudy to generally cloudy weather forecasted for next five days. • Rainfall : No rainfall forecasted. • Temperature: Maximum and minimum temperature likely to be in range of 35-36°C and 24-25°C, respectively. • Relative Humidity: The RH-I and RH-II is likely to be in the range of 72-80% & 40-43, respectively. • Wind Direction and Speed: Direction and speed of wind is likely to be W and 19-31 km/h, respectively. 					

(3) DEVBHUMI DWARKA DISTRICT:

	06/09/2023	07/09/2023	08/09/2023	09/09/2023	10/09/2023
Rainfall (mm)	2	3	0	0	0
Max.Temp.(°C)	32	33	32	32	32
Min.Temp.(°C)	27	26	25	25	26
RH-I (%)	82	81	83	83	87
RH-II (%)	61	56	61	62	77
Wind Speed (kmph)	17	21	26	27	27
Wind Direction(deg.)	257	292	292	283	252
Total CC (octa)	4	4	5	8	7
<ul style="list-style-type: none"> • General weather: Dry, warm and partly cloudy to generally cloudy weather forecasted for next five days. • Rainfall : Very light to light rainfall at isolate place during 06 to 07-September-2023. • Temperature: Maximum and minimum temperature likely to be in range of 32-33°C and 25-27°C, respectively. • Relative Humidity: The RH-I and RH-II is likely to be in the range of 81-87% & 56-77, respectively. • Wind Direction and Speed: Direction and speed of wind is likely to be W and 17-27 km/h, respectively. 					

(4) SURENDRANAGAR DISTRICT:

	06/09/2023	07/09/2023	08/09/2023	09/09/2023	10/09/2023
Rainfall (mm)	0	0	0	0	0
Max.Temp.(°C)	35	36	36	36	35
Min.Temp.(°C)	25	25	24	25	24
RH-I (%)	71	69	71	71	77

RH-II (%)	40	40	41	40	40
Wind Speed (kmph)	18	23	26	27	27
Wind Direction(deg.)	292	294	292	270	257
Total CC (octa)	4	6	5	7	6
<ul style="list-style-type: none"> • General weather: Dry, warm and partly cloudy to generally cloudy weather forecasted for next five days. • Rainfall : No rainfall forecasted. • Temperature: Maximum and minimum temperature likely to be in range of 35-36°C and 24-25°C, respectively. • Relative Humidity: The RH-I and RH-II is likely to be in the range of 69-77% & 40-41, respectively. • Wind Direction and Speed: Direction and speed of wind is likely to be W and 18-27 km/h, respectively. 					

(5) AMRELI DISTRICT:

	06/09/2023	07/09/2023	08/09/2023	09/09/2023	10/09/2023
Rainfall (mm)	1	2	8	3	5
Max.Temp.(°C)	35	35	34	34	32
Min.Temp.(°C)	25	25	25	26	25
RH-I (%)	84	77	79	81	85
RH-II (%)	48	42	44	48	56
Wind Speed (kmph)	17	21	23	24	23
Wind Direction(deg.)	283	292	292	288	288
Total CC (octa)	4	6	7	8	7
<ul style="list-style-type: none"> • General weather: Dry, warm and partly cloudy to generally cloudy weather forecasted for next five days. • Rainfall : Very light to light rainfall at isolate place during 06 to 10-September-2023. • Temperature: Maximum and minimum temperature likely to be in range of 32-35°C and 25-26°C, respectively. • Relative Humidity: The RH-I and RH-II is likely to be in the range of 77-85% & 42-56, respectively. <p>Wind Direction and Speed: Direction and speed of wind is likely to be W and 17-24 km/h, respectively.</p>					



(6) JAMNAGAR DISTRICT:

	06/09/2023	07/09/2023	08/09/2023	09/09/2023	10/09/2023
Rainfall (mm)	0	0	0	0	0
Max.Temp.(°C)	33	34	34	34	33
Min.Temp.(°C)	25	25	24	25	24
RH-I (%)	82	80	83	82	86
RH-II (%)	51	50	54	55	70
Wind Speed (kmph)	17	23	27	28	28
Wind Direction(deg.)	288	292	292	283	249
Total CC (octa)	4	5	5	8	7
<ul style="list-style-type: none"> • General weather: Dry, warm and partly cloudy to generally cloudy weather forecasted for next five days. • Rainfall : No rainfall forecasted. 					


- **Temperature:** Maximum and minimum temperature likely to be in range of 33-34°C and 24-25°C, respectively.
- **Relative Humidity:** The RH-I and RH-II is likely to be in the range of 80-86% & 50-70, respectively.
- **Wind Direction and Speed:** Direction and speed of wind is likely to be W and 17-28 km/h, respectively.


Agro meteorological Advisories:

<p>General Advice</p>	<p>General Advisory Under moisture stress condition following activity should be taken to save crop</p> <ul style="list-style-type: none"> • Create soil mulch by interculturing as per need in all kharif crops. • Complete removal of weeds to save soil moisture. • Due to extended dry spell apply life saving irrigation through drip/sprinkler under moisture stress condition. • To protect crop against sucking pests like jassid, thrips and aphid spray imidachlopride 30.5 % SC 4 ml/10 litre water. • Do not apply any kind fertilizer under moisture stress condition. • Spray anti-transpirant Kaoline 4 % solution i.e 400 gm kaolin in 10 litre of water in cotton and groundnut crops. • Straw, groundnut shell and agricultural waste mulching in wide space crops is advisable under moisture stress condition. • When moisture extended for long period, thinning should be done. If more moisture stress prevails, remove alternate row and thin the plant in the field. • Carry out earthing up in cotton. • Alerts & Warning: NIL • Weather outlook for subsequent week: As per extended range forecast dry and mainly clear to partly clody weather likely to observe during 10 to 15-September-2023. • Sms : Complete removal of weeds to save soil moisture under moisture stress condition. 		
<p>Crops</p>	<p>Stage</p>	<p>Insect/Pest/ Variety</p>	<p>Advisory</p>
<p><i>Kharif groundnut</i></p>	<p>Flowering, pegging & pod formation</p>	<p>Stem rot/White fungus Leaf spot</p>	<ul style="list-style-type: none"> • Apply 2.5 kg/ha Trichoderma fungus with well decompose FYM OR castor cake @ 500 kg/ha as preventive measures against Sclerotium rolfsii stem rot. • Spray Hexaconazole or Propiconazole 10 ml/10 lit of to prevent leaf spot & rust infestation in

		 <p>White grub</p>  <p>Heliiothis & Prodenia</p>	<p>groundnut under clear weather.</p> <ul style="list-style-type: none"> • Do drenching of Chlorpyrifos 20 % EC or Quinalphos 25 % EC 4 liters/ha or mix Chlorpyrifos 20 % EC or Quinalphos 25 % EC 4 litres with 100 kg sand and broadcast in 1 hectare area and irrigate if there is no rainfall. • DO spray of Beauveria bassiana@ 40 gm/10 litre of water for the control of Heliiothis & Prodenia infestation in groundnut crop under clear weather.
<p>Cotton</p>	<p>Squaring, Flowering and ball formation</p>	<p>Weeding</p> <p>Thrips & Jassids</p> <p>Pink boll worm</p>	<ul style="list-style-type: none"> • Carry out interculturing and weeding to conserve soil moisture. • Under present weather condition, thrips & jassids infestation observed in cotton, at above ETL spray acephate 75 % SP 15 gm or Flonicamid 3 gm with 1500 ppm neem oil 40 ml /10 litre of water. • Under present weather condition pink bollworm infestation observed in cotton. For the monitoring of pink bollworm infestation in cotton crop farmers are advised to put pheromone traps 6-8/ha. If infestation found, pick and burry the infested flowers/bolls in soil for control of pink bollworm infestation in cotton. Also make spray of profenofos 50 EC 20 ml in 10 liters of water. • Farmers are advised to spray 3 % KNO3 solution in at flowering, boll initiation and 50% boll formation to Bt. Cotton crop. • Foliar spraying of multi-micronutrient formulation Grade IV (Fe-Mn-Zn-CuB, 4.0-1.0-6.0-0.5-0.5 %) @ 1% at 60, 75 and 90 DAS in Bt. cotton crop is advised. • Detopping of cotton should be done in crop having 4.5-5 feet height. • Under present weather, farmers are advised to spray 30 ppm Naphthalene Acetic Acid solution (planofix 7.5 ml/10 liter of water) to prevent dropping of flowering .

Sesame	Capsule formation & development	- Leaf Webber Fungal leaf spot Mites	<ul style="list-style-type: none"> • Carry out weeding to conserve soil moisture. • If infestation of leaf Webber observe above ETL, spray Cartep Hydrochloride 15 gram in 10 litres of water OR Neem Seed Kernel Extract (NSKE) 3% (300g /10 l water). • Spray Ridomil (Metalaxyl 4 % + Mencozeb 64 % WP) 20 gm/litre of water for prevention of infestation of Alternaria/fungal leaf spot/pm disease in sesame. • Under present weather condition mite infestation observe in sesame, to control mite spary propargite 57 % EC 15 ml/10 litre of water.
Pearl millet	Milking and grain development	-.	<ul style="list-style-type: none"> • Carry out weeding as per need.
Green gram	Pod development & maturity	-.	<ul style="list-style-type: none"> • Pick the mature pods in time.
Black gram	Pod formation & development	-.	<ul style="list-style-type: none"> • Carry out weeding.
Cow pea	Pod development & maturity	Aphids and leaf minor	<ul style="list-style-type: none"> • Pick the mature pods in time.
Pigeon pea	Germination/ growth	BDN-2, GT-100, GJP-1, Vaishali	-
Castor	Germination/growth	Prodenia & semilooper	<ul style="list-style-type: none"> • spray Emamectin Benzoate 5 gm/10 litre of water for the control of Prodenia infestation in castor crop under clear weather. • Carry out inter culturing and weeding to conserve soil moisture.
Ridge gourd, Bottle gourd, Sponge guard, Bittergourd, Cluster bean, Water melon	Flowering & fruiting	White fly Downy mildew	<ul style="list-style-type: none"> • In all broad leafy vegetables whitefly infestation observed above ETL. Spray 500 ml of 5 % neem seed extract or neem seed oil 50 ml with acetamiprid 20 % SP@ 5.0 gm or imidacloprid 30.5 SC4 ml/10 lit of water for whiteflies control. • If mite population is found more, then spraying of Ethion @ 1.5-2 ml/litre of water for the control of Mites in cucurbiteous . For the control of downy mildew spray mencozeb 40g/pump.

Ladyfinger	Flowering/fru iting	White flies & Mites	<ul style="list-style-type: none"> • Spray 500 ml of 5 % neem seed extract or neem seed oil 50 ml with with acetamiprid 20 % SP@ 5.0 gm or Difenthiuron 50 WP @ 16 gm / 10 lit of water. • /10 lit of water for whiteflies control in okra. • Constant monitoring of ladyfinger crop against attack of mite is advised. If population is found more, then spraying of Ethion @ 1.5-2 ml/litre of water is advised. • After harvesting of mature okra application of urea @ 20 kg/ acre should be done.
Brinjal	Flowering/ fruiting	White fly→ Shoot &Fruit borer	<ul style="list-style-type: none"> • To minimize population of whitefly, Spray 500 ml of 5 % neem seed extract or neem oil 50 ml with Difenthiuron 50 WP @ 16 gm / 10 lit of water. • In brinjal, monitoring of borers by using pheromone traps 4-6 per acre is advised. For control of shoot and fruit borer in brinjal, infested fruits and shoots should be collected and buried into the soil. If fruits and shoot borer population is above ETL then spraying of chlorantraniliprole 18.5 % SC 3.0 ml /10 litre of water is advised.
Chili	Flowering & fruiting	Thrips →  Mites Viral leaf curling	<ul style="list-style-type: none"> • For control of thrips, spray Profenofos 20 ml with 500 m of 5 % neem seed extract or neem seed oil 50 mlin 10 litres of water. In case of severe attack, spray Spinosad or Spinetoram 3 or Fluxametamide 10 % EC 11 ml per 10 liter of water. • If infestation of mite observed in chilli, then spray Ethion 50 EC 15 ml or Propargite 57 % EC @ 10 ml/ 10 litre of water. • Under weather conditions, rouging of viral infested plants should be done in chilli. Infected plants should be uprooted and buried in the soil. After rouging, spraying of Imidacloprid @ 3 ml per 10 litre of water is advised to control the vector.
Lemon	Fruit development	Citrus canker Leaf minor	<ul style="list-style-type: none"> • Spray copper oxychloride 40 gm or streptocyclie 1.5 gm in 10 liters of water for the control of citrys canker in lemon. • Spray Imidacloprid 30.50SC @ 3 ml per in 10

			liters of water for control of leaf minor.
Livestock & poultry 	Spray Deltamethrin or Amitraz 2 ml/litre of water for the control of tick. Deworming, T.B. and J.D. Testing should be done. Provide 6-8 kg good quality dry roughage with 15-20 kg green fodder to the animals. For milch animals, regularly follow schedule of 1 kg feed + 50 g mineral mixture per 2 liters of milk yield. Feed animals with a mixture of green grass + hay + minerals + dry feed. Ensure regarding vaccination of animals for different diseases in rainy season. Spray phenyl in the animal shed to avoid fly's and mosquitoes. Keep fodder in safe place to avoid spoilage due to rainfall.		
Note	Kindly download <ul style="list-style-type: none"> • MAUSAM App for location specific forecast & warning. • MEGHDOOT App for Agromet advisory. • DAMINI App for lightning warning. 		

Technical Officer, GKMS Unit, DFRS, JAU, Targhadia.